



PBT-02014106 Seat No. _____

M. A. (Education) (Sem. III) (CBCS) Examination

December - 2018

Paper - 01 : Research Methodology - III

(New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) મુખ્ય ગ્રાણ પ્રશ્નો આપેલ છે. તમામ ફરજિયાત છે.
 (૨) વિકલ્પ આંતરિક આપેલ છે. સૂચના અનુસાર ઉત્તરો લખવા.
 (૩) જમણી બાજુનો આંક ગુણ દર્શાવે છે.

૧ નીચેના દરેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો : (પ્રત્યેકના ૨ ગુણ) ૧૬

- (૧) સંશોધનમાં નિષ્ણાંતનો અભિપ્રાય ક્યાં-ક્યાં તથકે લેવામાં આવે છે ?
- (૨) અપ્રાચલીય ક્સોટીના કોઈ બે નામ લખો.
- (૩) ક્સોટીની શક્તિ એટલે શું ?
- (૪) ભાવી સંશોધનની ભલામણ કોણ ઉપયોગ કરી શકે ?
- (૫) પ્રારંભિક સાહિત્ય એટલે શું ?
- (૬) સાર્થકતા કક્ષા O.O.૧નું અર્થઘટન કરો.
- (૭) પાદનોંધ એટલે શું ?
- (૮) સંદર્ભસૂચીમાં કઈ કઈ વિગતો લખવામાં આવે છે ?

૨ નીચેના દશ પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપો : ૨૪

- (દશ માંથી આઠ) (પ્રત્યેકના ૩ ગુણ)
- (૧) સંશોધન અહેવાલનું મૂલ્યાંકન કઈ બાબતોને ધ્યાને લઈ કરવામાં આવે છે ?
 ટૂંકમાં માહિતી આપો.
- (૨) પાદનોંધમાં સંક્ષેપીકરણ એટલે શું ?
- (૩) સંશોધન સમસ્યાના પરિચય પ્રકરણનું અહેવાલ લેખન કરતા કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે ?
- (૪) કેવા પ્રકારની માહિતીના પૃથક્કરણમાં કાઈ-વર્ગ ક્સોટીનો ઉપયોગ કરવામાં આવે છે ? આવા પ્રકારની માહિતીનું ઉદાહરણ આપો.

- (૫) કોઈ પણ ગ્રાન્ટ શુન્ય ઉત્કલ્પનાના ઉદાહરણ લખો.
- (૬) સહસંબંધિત અને અસહસંબંધિત માહિતી ઉદાહરણ સાથે સમજાવો.
- (૭) ઉદાહરણ દ્વારા સમજાવો : પ્રકાર-૧ની ભૂલ અને પ્રકાર-૨ની ભૂલ
- (૮) માહિતીના પૃથક્કરણ માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિની પસંદગી માટેના આધારો લખો.
- (૯) સંશોધન અહેવાલ લેખનમાં સારણી અને આકૃતિ દર્શાવવામાં શી કાળજી રાખવી પડે ?
- (૧૦) સંશોધન અહેવાલના માળખાનો ટુંકમાં પરિચય આપો.

- ૩ નીચેના આઠ પ્રક્રિયામાંથી કોઈ પણ છ પ્રક્રિયાના મુદ્દાસર ઉત્તર આપો : ૩૦
 (આઠ માંથી છ) (પ્રત્યેકના પાંચ ગુણા)
- (૧) નીચેની પ્રત્યેક સંકલ્પના ઉદાહરણ સાથે સમજાવો.
 - (અ) સ્વતંત્ર ચલ
 - (બ) પરતંત્ર ચલ
 - (ક) અંકુશિત ચલ
 - (ઢ) સતત માહિતી
 - (ઝ) અસતત માહિતી
 - (૨) સંશોધન અહેવાલ તૈયાર કરવામાં કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે ?
 વિસ્તૃત નોંધ તૈયાર કરો.
 - (૩) ટૂંકનોંધ લખો : વિચરણ પૃથક્કરણ અને Z - ક્સોટી
 - (૪) નોંધ લખો : વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર અને અર્થઘટનાત્મક આંકડાશાસ્ત્ર
 - (૫) સમજાવો : એક પુષ્ટી ક્સોટી અને દ્વિપુષ્ટી ક્સોટી
 - (૬) માહિતી પૃથક્કરણ અને અર્થઘટન પ્રકરણનું અહેવાલ લેખન કઈ રીતે કરવામાં આવે છે ? સમજાવો.
 - (૭) ઉદાહરણ સાથે સમજાવો : સ્વતંત્ર કક્ષા અને નમુનાની પ્રમાણભૂલ
 - (૮) સંશોધન અહેવાલમાં નીચેના સંદર્ભ APA શૈલીમાં કઈ રીતે લખાય ?
 ઉદાહરણ આપી સમજાવો.
 - (અ) અપ્રકાશિત લઘુશોધ નિબંધ
 - (બ) પુસ્તક
 - (ક) સંશોધન સામયિક

ENGLISH VERSION

Instructions : (1) Main three questions are given. All are compulsory.
(2) Choices are given internally.
(3) Write answers as per given instruction.
(4) Right side figure is indicating marks.

- 1** Answer the following questions in brief : **16**
(Each has two marks)
- (1) In research at which stages we should have getting expert's opinion ?
 - (2) Write any two names of non-parametric test.
 - (3) What is Power of Test ?
 - (4) Who can utilize future research recommendations ?
 - (5) What is Primary Reference ?
 - (6) Give interpretation of significant level 0.01.
 - (7) What is footnote ?
 - (8) Which details are write down in Bibliography ?
- 2** Answer any eight out of ten of the following questions : **24**
(any eight out of ten) (Each has three marks)
- (1) On which bases research report's evaluation done ?
Give short detail.
 - (2) What is briefing in footnote ?
 - (3) Which parameters are kept in mind when we writing chapter introduction of research problem ?
 - (4) In which type of data's analysis we can use chi-square test ? Give example of this data.
 - (5) Write any three examples of null hypothesis.
 - (6) Give understanding with proper example of correlated data and uncorrelated data.
 - (7) Give understanding with proper example : Type-1 Error and Type-2 Error.
 - (8) Write bases of selection for statistical technique for data analysis.

- (9) Which care we have to keep in mind for indicating table and figure in research report ?
- (10) Give brief introduction of Research Report framework.
- 3** Answer any six out of eight of the following questions : **30**
(any six out of eight) (Each has five marks)
- (1) Give understanding with example of given below concept.
 - (a) Dependent variable
 - (b) Independent variable
 - (c) Control variable
 - (d) Continuous data
 - (e) discrete data
 - (2) Which matters are kept in mind when we prepare Research Report ? Give detail notes.
 - (3) Write a short note on : Variance Analysis and Z-test.
 - (4) Write a short note on : Descriptive Statistics and Interpretative Statistics.
 - (5) Give detail Understanding on : On Tail Test and Two Tail Test
 - (6) Describe : How to write a report of chapter Data Analysis and Conclusion.
 - (7) Give understanding with proper example of Degree of freedom and Error in sampling.
 - (8) How given below references can wrote in APA style ?
Give an understanding with proper example.
 - (a) Unpublished Minor Dissertation
 - (b) Books
 - (c) Research Magazine.